

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન અને રાયરસન યુનિવર્સિટી દ્વારા ઈનોવેશન ઝોન પર સીમાચિહ્નરૂપ કરાર કરવામાં આવ્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 7, 2020) – સીટી ઓફ બ્રેમ્પટન અને રાયરસન યુનિવર્સિટીએ ડાઉનટાઉન બ્રેમ્પટનમાં રાયરસન ઈનોવેશન ઝોન સ્થાપવા એક કરાર પર સહી કરી છે, જે શહેરમાં પોસ્ટ-સેકન્ડરી (માધ્યમિક પર્યંત) શિક્ષણ માટે રોમાંચક સીમાચિહ્ન બન્યું છે.

રાયરસનની આગેવાનીમાં બ્રેમ્પટન ઈનોવેશન ઝોન રાયરસન યુનિવર્સિટીના વિશ્વ પ્રખ્યાત [ઝોન નેટવર્ક](#)ને મોડેલ તરીકે અનુસરે છે અને તેની સાથે સંકળાયું છે. આ સ્થળો લોકોને તર્કસભર વિચારણા કરવા, પ્રોજેક્ટ્સ ઝડપી શરૂ કરવા, અને સ્ટાર્ટ-અપ્સથી શરૂઆતના તબક્કાની વિકસતી કંપનીઓમાંથી સ્થાપિત સમૃદ્ધ ધંધાઓમાં પરિવર્તિત કરવામાં મદદ મેળવવા ડિઝાઇન કરવામાં આવ્યા છે. નવો ઈનોવેશન ઝોન બ્રેમ્પટનમાં સ્કેલેબલ ધંધાઓના વિકાસ પર, ઉચ્ચ સંભવિત ઉદ્યોગ સાહસિક ટીમો બનાવવા અને સહાય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઈનોવેશન ઝોન આ કરશે:

- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોને વિચારશીલ નેતૃત્વ અને પ્રવેશ પૂરો પાડશે, અને ઉત્કૃષ્ટતાની પ્રતિષ્ઠિતતા બનાવશે
- નવા ધંધાઓની વૃદ્ધિને ટેકો આપીને અને સ્વનાત્મક ઉદ્યોગો, ડિજિટલ હોસ્પિટાલિટી, બુદ્ધિગમ્ય પરિવહન, અને ટેકનોલોજી-સક્ષમ આરોગ્ય સેવાઓ જેવા હયાત ઉદ્યોગોમાં નવીન શોધને પ્રોત્સાહન આપીને ધંધાકીય માળખાગત સગવડ વિસ્તારશે
- સીટી ઓફ ઓપર્યુનિટીસ (તકો આપતું શહેર) બનાવીને બ્રેમ્પટન 2040 વિઝનને સહાયતા કરશે
- સ્થાનિક પ્રતિભાઓ વિકસાવશે, આકર્ષશે અને રોકી રાખશે
- સહભાગી ભાગીદારો મારફતે ધંધાઓ, શિક્ષણ અને સરકારના તમામ ક્ષેત્રોમાંથી પ્રભાવકોનું નેટવર્ક બનાવશે અને પાલનપોષણ કરશે

બ્રેમ્પટન એક મજબૂત નવીનતમ પર્યાવરણતંત્રને સહાય કરવા તમામ જરૂરી ભાગોને સાથે રાખી રહ્યું છે. ઈનોવેશન ઝોન વર્ષ 2020 ની શરૂઆતમાં ખુલશે અને બ્રેમ્પટનના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં નવો ઉમેરો થશે, જેમાં સામેલ છે:

- રોજર્સ સાઈબર સિક્યોરિટી કેટાલિસ્ટ
- બ્રેમ્પટન એન્ટરપ્રિન્યોર સેન્ટર (વિચારણા અને સહકાર કેળવવાનું સ્થળ)
- રાયરસન-બ્રેમ્પટન ઈનોવેશન ઝોન (સ્ટાર્ટઅપ ઈનક્યુબેટર)
- શહેરના નવીન શોધ માટેના ભાવિ કેન્દ્ર માટેનું સ્થળ
- એક સ્કેલ-અપ ઈનક્યુબેટર

અવતરણો (ક્વોટ્સ):

“આ બ્રેમ્પટન અને રાયરસન યુનિવર્સિટી સાથે આપણી અવિરત ભાગીદારી માટે એક રોમાંચક ક્ષણ છે. આ ઈનોવેશન ઝોન આપણને સંપૂર્ણપણે વિકસિત નવીનતમ પર્યાવરણતંત્ર સુધી એક પગલું વધારે નજીક લાવે છે, જે ઉદ્યોગ સાહસિકોને પોતાના પ્રવાસના દરેક તબક્કે સહાય કરે છે. અમે બ્રેમ્પટનના વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને ભાવિ કાર્યદળની જરૂરિયાતોને સંબોધવા તમામ સંભવિત વિકલ્પો અને ભાગીદારીઓ પર કામ કરવા કટિબદ્ધ છીએ. અમારી સાથે રાયરસન યુનિવર્સિટી એક મહાન ભાગીદાર છે અને અમે તેઓની સહયોગી ભાવના બદલ તેઓના આભારી છીએ. અમે આગામી ઘણાં વર્ષો આવા રહે તેવી આશા રાખીએ છીએ.”

– મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

"અમે સ્ટાર્ટ-અપ્સ અને ઈનક્યુબેશનનો અમારો અનુભવ અને નિપુણતાને બ્રેમ્પટનના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં લાવવા આશાવાદી છીએ અને હું આ દૂરંદેશીપણામાં તેઓની કટિબદ્ધતા બદલ સીટી ઓફ બ્રેમ્પટનનો આભાર માનું છું. બ્રેમ્પટનમાં રાયરસન ઈનોવેશન ઝોન વિચારોને પોષવામાં અને ઉદ્યોગ સાહસિકોને પ્રેરેશમાંની વિવિધ સંસ્થાઓ સાથે જોડવાની સાથે સાથે, તેઓને આધુનિક અર્થતંત્રમાં સફળ થવા અને ટકી રહેવા જરૂરી સટીક વિચારણા અને સમસ્યા નિરાકરણ આવડતોથી સજ્જ કરવામાં મદદ કરશે."

– મોહમદ લાચેમી (Mohamed Lachemi), પ્રેસિડન્ટ અને વાઈસ-ચાન્સેલર, રાયરસન યુનિવર્સિટી

-30-

કેનેડામાં સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકી એક, બ્રેમ્પટન 650,000 લોકો અને 70,000 ધંધાઓનું ઘર છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

રાયરસન યુનિવર્સિટી નવીનતમ, કારકિર્દીલક્ષી શિક્ષણમાં કેનેડામાં આગેવાન છે. શહેરી, સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર અને સર્વગ્રાહી, આ યુનિવર્સિટી 2,600 માસ્ટર્સ અને PhD વિદ્યાર્થીઓ, 3,800 ફેકલ્ટી અને કર્મચારીઓ, અને દુનિયાભરમાં આશરે 198,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત, 45,300 થી વધારે વિદ્યાર્થીઓનું ઘર છે. વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, ryerson.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca